



સાક્ષરતા



સક્ષમતા



સ્વચ્છતા



સ્વાસ્થ્ય

જા.નં. : શા.શી./૪૪/૨૦૨૦

તારીખ : ૦૫-૦૯-૨૦૨૦

**વિષય :** સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેવાડાનાં માનવી સુધી પહોંચી તેમની સેવા કરવા માટે “પ્રેમનો પટારો” અને “WISDOM ON WHEELS” (WOW) બસ સેવા એમ બે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. આપ આપની કોલેજમાં કોલેજકાળ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલ આ બન્ને પ્રોજેક્ટમાં અઠવાડિયામાં બે કલાક સેવા આપવા માટે કોલેજ ભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વોલીયન્ટર તરીકે જોડાવા બાબત.

### ❖ પરિપત્ર :

- ❖ આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સર્વે કોલેજ/ભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને જણાવવાનું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેવાડાનાં માનવી સુધી પહોંચવા અને તેમને મદદરૂપ થવા અનેક પ્રકલ્પ ચલાવવામાં આવે છે.
- ❖ જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રેમનો પટારો અને WISDOM ON WHEELS એટલે કે WOW બસ સેવા શરૂ કરવામાં આવેલ છે.

### ❖ પ્રેમનો પટારો :

- ❖ “પ્રેમનો પટારો” સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રાખવામાં આવેલ છે. આ પ્રેમનો પટારો એટલે કે સાદી ભાષામાં કહીએ તો માનવતાની દિવાલ.
- ❖ આપણા ઘરમાં આપણી એવી ઘણી ચીજ-વસ્તુઓ છે કે જેને થોડા સમય પછી આપણે ઉપયોગ નથી કરતા એટલે કે આ ચીજ-વસ્તુઓ આપણા માટે સેકન્ડ હેન્ડ બની ગઈ છે.
- ❖ જેમ કે જુના ચોપડા, જુની નોટબુકો કે જેમાં હજુ પણ પેજ ખાલી છે. અને જેમાં લખી શકાય એવી જગ્યા છે.
- ❖ જુના કપડા, જુના રમકડા, જુના ચંપલ, જુના બુટ, જુના ટેપ રેકોર્ડર, જુના લેપ-ટોપ, જુના કોમ્પ્યુટર એવી કંઈ પણ વસ્તુ કે જે તમારા માટે જુની થઈ ગઈ છે. પરંતુ અન્ય વ્યક્તિઓ માટે નવી છે.
- ❖ રોજ બરોજના ઉપયોગમાં આવી વપરાશી વસ્તુઓ તમે પ્રેમનાં પટારા અંતર્ગત મુકો અને આ તમામ વસ્તુઓ આપણે જરૂરિયાત મંદ લોકોને આપીએ.

શારીરિક શિક્ષણ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

Email : phyedu@sauuni.ac.in

Phone No.:0281- 2578501/111/427





સાક્ષરતા



સક્ષમતા



સ્વચ્છતા



સ્વાસ્થ્ય

જા.નં. : \_\_\_\_\_

તારીખ : \_\_\_\_\_

- ❖ ઘણા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો એવા પણ હશે કે જરૂરિયાત મંદ લોકોને નવી નકોર વસ્તુઓ પણ આપવા ઈચ્છતા હશે તો એ પણ આપ દાન સ્વરૂપે આપી શકશો.
- ❖ આપ આપના અઠવાડિયા માંથી બે કલાક આ પ્રેમનાં પટારા અંતર્ગત સેવા કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વોલીયન્ટર બની સેવા મિત્ર તરીકે જોડાઓ. આપનું સમયદાન અને આપનું વસ્તુદાન અનેક લોકોના જીવનમાં દીપ પ્રગટાવશે એ નક્કી છે.
- ❖ “પ્રેમ નો પટારો” પ્રકલ્પમાં જોડાવા માટે અમો આપને આહવાન કરીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ.

#### ❖ WISDOM ON WHEELS:-

- ❖ જિલ્લા કલેક્ટર તંત્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા “WISDOM ON WHEELS” એટલે WOW બસ સેવા શરૂ કરવામાં આવેલ છે.
- ❖ જેમાં સાક્ષરતા, સ્વચ્છતા, સક્ષમતા અને આરોગ્ય આ ચાર આયામો અંતર્ગત સેવા કરવા માટે બસ સેવા શરૂ કરવામાં આવેલ છે.
- ❖ સાક્ષરતા અંતર્ગત સને ૨૦૨૦-૨૧ નાં વર્ષમાં ૩૦૦ બાળકોને સાક્ષર બનાવવાના સ્વપ્ન સાથે આ બસ સેવા શરૂ કરવામાં આવેલ છે.
- ❖ સ્વચ્છતા પ્રકલ્પ અંતર્ગત આપણી આજુબાજુનાં વિસ્તારમાં જે ગંદકી છે એ ગંદકી દૂર કરવા માટે આપણો સક્રિય ફાળો આપણે દાખવવાનો છે.
- ❖ સક્ષમતા પ્રકલ્પ અંતર્ગત સને ૨૦૨૦-૨૧ માં ૧૦૦૦ યુવાનોને સક્ષમ બનાવવાનું છે.
- ❖ મેડિકલ (સ્વાસ્થ્ય) પ્રોજેક્ટ અંતર્ગત આપણા ઘરની અંદર ઘરગથ્થું ઉપચારની અવેરનેસ રાજકોટનાં ૧૦૦૦૦ યુવાનોમાં કરવાનો ઉદ્દેશ્ય છે.
- ❖ આ ચાર પ્રકલ્પ માટે આપ આપણો અમુલ્ય સક્રિય ફાળો નોંધાવો એવી અમો અપીલ કરીએ છે.

- આગળ ચાલુ

શારીરિક શિક્ષણ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

Email : phyedu@sauuni.ac.in

Phone No.:0281- 2578501/111/427





સાક્ષરતા



સક્ષમતા



સ્વચ્છતા



સ્વાસ્થ્ય

જા.નં. : \_\_\_\_\_

તારીખ : \_\_\_\_\_

- ❖ આ બંને પ્રોજેક્ટ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જિલ્લા કલેક્ટર તંત્ર વતી અમો દરેક વિદ્યાર્થીને અપીલ કરીએ છીએ તેમજ આમંત્રિત પણ કરીએ છીએ કે અઠવાડિયામાં બે કલાક તમે આ સેવાકાર્ય માટે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સમય આપવા માટે નીચે દર્શાવેલ [GOOGLE LINK](#) માં ફોર્મ ઉપર કરી ક્લિક કરી તમે તમારું વોલીયન્ટર ફોર્મ ભરી આ સેવાકાર્યમાં તમે જોડાવ અને માનવ સાંકળ મજબૂત કરો.

- [GOOGLE LINK :- CLICK HERE](#)

--: વધુ માહિતી માટે સંપર્ક સુત્ર :-

- (૧) ડૉ. ચિરાગ સાવલિયા: મો.નં. ૮૦૦૦૪ ૮૦૦૦૭  
(કો-કોર્ડીનેટર-WISDOM ON WHEELS)
- (૨) શ્રી હાર્દિક ગોહિલ: મો. નં. ૮૮૦૫૦ ૧૬૦૪૨  
(કો-કોર્ડીનેટર-પ્રેમનો પટારો)
- (૩) શ્રી પ્રકાશ દુધરેજીયા: મો.નં. ૯૪૨૬૨ ૩૩૩૩૩  
( પ્રોજેક્ટ ઓફિસર)

ડૉ. મેહુલ રૂપાણી  
ડીન અને સિન્ડિકેટ સભ્ય  
પ્રોજેક્ટ કોર્ડીનેટર  
પ્રેમનો પટારો અને WISDOM ON WHEELS.  
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી  
રાજકોટ.

પ્રતિ,

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સર્વે કોલેજો/ભવનોના વિદ્યાર્થીઓ,

નકલ સાદર રવાના :- માન.કુલપતિશ્રી/ માનઉપકુલપતિશ્રી/માન.કુલસચિવશ્રીના અંગત સચિવશ્રી

શારીરિક શિક્ષણ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

Email : phyedu@sauuni.ac.in

Phone No.:0281- 2578501/111/427

